



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૪/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૭૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૯ કેસ કરી, ૮૫ વ્યક્તિઓને ઝડપી, ૩૧૫ લીટર દેશી દારૂ અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૦૬૭/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૭૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૭૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ :

સમાચાર યાદી નં.૬૭૪/૧૯

ખોખરા: મનીમારન કિષ્નસ્વામી પડાયી (ઉ.વ.૬૨)(રહે. વોરાની ચાલી ઇડલી ચાર રસ્તા મણિનગર)એ ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૪/૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૧૬/૦૪/૧૯ સવારના ૬/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૮,૭૦,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી બી.જે.ઝાલા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૬૭૫/૧૯

આનંદનગર: જીજ્ઞેશભાઈ હસમુખભાઈ શાહ (રહે.પદ્માવતી ફ્લેટ અંજલી સર્કલ પાસે પાલડી) એ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૪/૧૯ સાજના ૭/૩૦ થી રાતના ૮/૧૦ વાગ્યા દરમિયાન આનંદનગર સીમા હોલના ગેટ સામે પાર્ક કરેલ પોતાની આઈટેન ગાડીની દરવાજાનો કાચ તોડી, અજાણી વ્યક્તિ કારમાંથી રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- તથા ડોક્યુમેન્ટ સાથેની બેગ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.કે.બારડ ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઇ ગયો :-

સમાચાર યાદી નં.૬૭૬/૧૯

પાલડી: ઝરણાબહેન વા/ઓ નિકેશભાઈ શાહ (ઉ.વ.૨૯) (રહે,શારદાકુંજ સોસાયટી નવા વિકાસગૃહ રોડ દેનાબેંક સામે પાલડી) તા.૧૬/૦૪/૧૯ બપોરના ૩/૪૫ વાગ્યાના સુમારે પાલડી વી.આર.શાહ સ્કૂલ સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ ઝરણાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૩,૮૨૮/- ખેચી તોડી લઇ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ ઝરણાબહેન શાહે પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.જે.કરપડા ચલાવે છે.

લાશ મળી આવવા બાબત:-

સમાચાર યાદી નં.૬૭૭/૧૯

રીવરફ્રન્ટ ઇસ્ટ: તા.૧૬/૪/૧૯ બપોરના ૧/૪૦ વાગ્યાના સુમારે શાહપુર માસ્ટર કોલોની નજીકથી વિજયભાઈ દશરથભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૩) (રહે. ચન્દ્રનગર સોસાયટી રાયકાનગર સામે ચાંદલોડીયા) ની લાશ રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને મળી આવતા રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રવિણભાઈ અરખાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.